



**NBU-1601340102020400** Seat No. \_\_\_\_\_

**Master of Library & Information Science  
(W. E. F. 2016) (Sem. II) (CBCS) Examination  
April / May - 2017  
Information Processing & Retrieval**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- 1 कોઈ પણ એક નો આશરે ૧૦૦૦ શબ્દોમાં ઉત્તર આપો : ૧૪  
 (૧) માહિતી પુનઃપ્રાપ્તી પદ્ધતિના ઘટકો અને કાર્યો સમજાવો.  
**અથવા**  
 (૨) માહિતી સંવેદન એટલે શું ? તેની આવશ્યકતા અને પ્રોડક્ટ્સ સમજાવો.
- 2 કોઈ પણ એક નો આશરે ૧૦૦૦ શબ્દોમાં ઉત્તર આપો : ૧૪  
 (૧) નિર્દેશિકરણ એટલે શું ? પુર્વ સંયોજિત નિર્દેશિકરણ પદ્ધતિઓનો વિકાસ સમજાવો.  
**અથવા**  
 (૨) પાર્શ્વ સંયોજિત નિર્દેશિકરણ પદ્ધતિઓના લાભ અને ગેરલાભ ઉદાહરણ સાથે સમજાવો.
- 3 કોઈ પણ એક નો આશરે ૧૦૦૦ શબ્દોમાં ઉત્તર આપો : ૧૪  
 (૧) શબ્દ બંદોળ નિયંત્રણ શું કામ જરૂરી હોઈ છે ? ઉદાહરણ સાથે તેના સાધનો સમજાવો.  
**અથવા**  
 (૨) ઉલ્લેખનોંધ પૃથક્કરણ એટલે શું ? ઉલ્લેખનોંધ આધારિત નિર્દેશિકરણ સમજાવો.
- 4 ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે)  
 (૧) મેટાડેટાની અગત્ય સમજાવો.  
 (૨) થિસોરસનું માળખું સમજાવો.  
 (૩) ડેટા વેરહાઉસિંગ અને ડેટા માર્ફિનિંગનો તફાવત સમજાવો.  
 (૪) નિર્દેશિકરણ પદ્ધતિનું મૂલ્યાંકન

- ૪ નીચેના પ્રશ્નોના ઉત્તર એક/બે પંજિતઓમાં આપો : ૧૪
- (૧) સી સી એફ એટલે શું ? કોઈ બે ટેગ દર્શાવો.
  - (૨) ડિઝીટલ ઓફ્ઝેક્ટ એટલે શું ?
  - (૩) સર્વ એંજિન અને મેટા સર્વ એંજિનનો તફાવત.
  - (૪) શોધ વ્યુહરચના એટલે શું ?
  - (૫) સિયર્સ પ્રમાણે વિષય ભથ્થાળાના ઉદાહરણ આપો.
  - (૬) બુલિયન ઓપરેટરનો ઉપયોગ બતાવો.
  - (૭) કોઈ ચાર સર્વ ટેકનિકના નામ આપો.

## ENGLISH VERSION

- 1 Attempt any **one** in 1000 words : 14
- (1) Explain the components and functions of IR system  
**OR**
  - (2) What is information repackaging? Explain its need and products.
- 2 Attempt any **one** in 1000 words : 14
- (1) What is indexing? Explain development of pre coordinate indexing systems.  
**OR**
  - (2) Explain and illustrate merits and demerits of post coordinate indexing systems.
- 3 Attempt any **one** in 1000 words : 14
- (1) Why is vocabulary control necessary? Explain its tools with examples.  
**OR**
  - (2) What is citation analysis? Explain citation based indexing.

**4** Attempt any **two** short notes : **14**

- (1) Explain importance of Metadata.
- (2) Explain the structure of thesaurus.
- (3) Explain the difference between Data Warehousing and Data Mining.
- (4) Evaluation of indexing system.

**5** Attempt following questions in one or two lines : **14**

- (1) What is CCF? State any two tags.
  - (2) What is digital object?
  - (3) Difference between Search Engine and Meta Search Engine.
  - (4) What is search strategy?
  - (5) Give example of subject headings based on Sears.
  - (6) Show the use of Boolean Operators.
  - (7) Name any four search techniques.
-